



ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

(ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ અધિનિયમ નં. ૧૫/૨૦૨૩)

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH

[Gujarat Public Universities Act No. 15/2023]



પરીપત્ર

વિષય : આગામી સમયમાં યોજનાર D.M.L.T. ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી શરૂ કરવા બાબત.

(નવા અને જુના સોફ્ટવેર અંતર્ગત)

આથી ઉપરોક્ત વિષયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪ માં યોજનાર D.M.L.T. કોર્ષના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની તારીખ નીચે મુજબ રહેશે. નિયત સમય-મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે.

શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ માં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે કોલેજો દ્વારા નીચે મુજબના તબક્કાઓ પૂર્ણ કરેલ હશે, તે જ કોલેજોના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી થઇ શકશે. જેથી નીચે મુજબના તબક્કાઓ જે કોલેજ દ્વારા પૂર્ણ કરવામાં ના આવ્યા હોય તેવી કોલેજોએ વહેલી તકે પૂર્ણ કરી, નીચે મુજબની તારીખોમાં પરીક્ષા ફોર્મની એન્ટ્રી કરવાની રહેશે.

Steps	Menu Name
1. College/Dept. Subject Mapping	College/Department Configuration
2. Student Subject Mapping	Student Configuration
3. Release Students Subject Selection	
4. Student Division Mapping	Master
5. Add Program Term Division	
6. Students Roll No. Generation	Student Configuration

કોર્ષનું નામ	રેગ્યુલર ફી (રૂ.૧૯૫૦/-)	લેઇટ ફી [રેગ્યુલર ફી + ૫૦૦]	ઠંડાત્મક ફી [રેગ્યુલર ફી + ૫૦૦ + ૧૫૦૦]
D.M.L.T. (નવા અને જુના સોફ્ટવેર અંતર્ગત)	તા.૦૪/૦૫/૨૦૨૪ થી તા.૧૩/૦૫/૨૦૨૪	તા.૧૪/૦૫/૨૦૨૪	તા.૧૫/૦૫/૨૦૨૪

[ઉપરોક્ત અભ્યાસક્રમની થીયરી પરીક્ષા શરૂ થવાની સંભવિત તા.૧૩/૦૫/૨૦૨૪ રહેશે. જેની સર્વે સંબંધીતોએ ખાસ નોંધ લેવી.]

છેલ્લી તારીખ બાદ કરવામાં આવેલ સુધારો સોફ્ટવેર સ્વીકારશે નહીં. ઠંડાત્મક ફી ની તારીખ બાદ પણ જો કોઇ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાનું બાકી રહેલ હોય તો તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અત્રેની યુનિવર્સિટી ખાતેથી **ડબલ ઠંડાત્મક ફી [ઠંડાત્મક ફી × ૨(બે)]** ભરી પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

રેગ્યુલર ફીની છેલ્લી તારીખ સુધીમાં ચલણ જનરેટ કરવાનું રહેશે, તેવી જ રીતે લેઇટ ફી અને ઠંડાત્મક ફી માટે અલગ-અલગ ચલણ જનરેટ કરવાના રહેશે. જો કોઇ કોલેજ દ્વારા ઉપર મુજબ ચલણ જનરેટ કરવામાં નહીં આવે તો ત્યારબાદની તારીખમાં ચલણ જનરેટ થશે નહીં જેની ગંભીરતાથી નોંધ લેવી.





ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

(ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ અધિનિયમ નં. ૧૫/૨૦૨૩)

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH

[Gujarat Public Universities Act No. 15/2023]



છેલ્લી તારીખ બાદ ચાલુ કામકાજના દિવસ ૨(બે)માં ફરજિયાત પણે ચેકલિસ્ટ તેમજ બેંકમા ભરેલ ચલણની રસીદ પરીક્ષા વિભાગમાં જમા કરવાના રહેશે, જો કોલેજ દ્વારા નિયત સમયમર્યાદા બાદ પરીક્ષા ફોર્મ જમા કરવામાં આવશે તો તેવી કોલેજના બેંક નંબર જનરેટ થશે નહીં જેથી તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોલેજની રહેશે. જેની ગંભીરતાથી નોંધ લેવી. નવા સોફ્ટવેરના પરીક્ષા ફોર્મ ફી બેંકમાં ઓફલાઇન ચલણ દ્વારા ભરવાની રહેશે તેમજ જુના સોફ્ટવેરમા ભરેલ ફોર્મ ચેકલિસ્ટ તેમજ ફી મેમો તેમજ ફી ભર્યાની રસીદ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનો રહેશે, તથા પરીક્ષા ફોર્મ ફી “રજીસ્ટ્રાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ” ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.

ખાસ નોંધ :

૧. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં જે વિષય દર્શાવેલ હોય તે જ વિષયની કોલેજ દ્વારા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી.
૨. કોલેજ દ્વારા પરીક્ષા ફોર્મની એન્ટ્રી થયા બાદ ફરજિયાત વેરીફાય કરી લેવાનું રહેશે.
૩. પરીક્ષાના આવેદનપત્ર કોલેજ પોતાની પાસે રેકૉર્ડમાં સાચવીને રાખવાં, જરૂર પડયે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજૂ કરવાનાં રહેશે.

૪. પરીક્ષા ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓના ABC ID ની ઓનલાઇન એન્ટ્રી કરવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓના ABC ID બનાવેલ ન હોય તેવા વિદ્યાર્થીઓના ABC ID બનાવી ત્યારબાદ પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.

ડી. ડી. એમ. યુનિવર્સિટી
પરીક્ષા નિયામક

બીડાણ : D.M.L.T. ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મ નવા સોફ્ટવેરમાં ભરવાની માર્ગદર્શિકા
HELP LINE-0285-2681409

ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૫૯૫/૨૦૨૪

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા. ૦૪/૦૫/૨૦૨૪

પ્રતિ,

યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તરફ....

નકલ સવિનય રવાના :-

(૧) માન.કુલપતિશ્રીના અંગત સચિવશ્રી (જાણ અર્થે)

(૨) આઈ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા તેમજ યોગ્ય કાર્યવાહી અર્થે)

(૩) હિસાબી શાખા. (યોગ્ય કાર્યવાહી અર્થે)

Page 2 of 2

સરકારી પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,
ખડિયા, જૂનાગઢ-૩૬૨ ૨૬૩, ગુજરાત(ભારત)
ફોન નં.૦૨૮૫-૨૬૮૧૪૦૦ / ફેક્સ નં.૦૨૮૫-૨૬૮૧૫૦૩



: www.bknmu.edu.in ||



: exam@bknmu.edu.in

Government Polytechnic Campus,
Bhakta Kavi Narsinh Mehta University Road,
Khadiya, Junagadh-362263 (Gujarat)
Ph: 0285-2681400 Fax: 0285-2681503

Help Manual


Subject Selection mapping Module For college

College /Department Subject Mapping

- Logging Your Username and password

<https://bknmuerp.in>

- Select [College / Department Management](#) module



Step : 1

- Go to College Department Configuration then select college/Department Subject Mapping
- Choose subject for which your college has been granted university permission

Academic Year 2023-2024

BKNMU

Academic Year : 2022-2023 Welcome, CL010230

Department

View College / Department Subject Mapping Details

+ PLEASE CLICK + Add NEW COLLEGE DEPTMENT SUBJECT MAPPING

Admission Year : * 2022-2023

College / Department Subject Mapping S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE

Program Name : * -Please Select-

Academic Batch Name : * -Please Select-

Show 30 entries per page Search:

Sr. No.	Admission Year	College / Department Name	Program Name	Academic Batch Name	Term	No. of Subjects	Edit	Delete
No data available in table								

Showing 0 to 0 of 0 entries Previous Next

https://department.bknmuerp.in/College/ViewCollegeSubjectMapping.aspx

Type here to search 30°C Smoke ENG 3:00 PM IN 09-Dec-22

- Click “ + “ Symbol Add New College/Department Subject Mapping

Admission Year 2023-2024

Admission Year: 2022-2023

College / Department: S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE

Program Name: BACHELOR OF ARTS

Academic Batch Name: B.A. 2022-23

Term: B.A. Semester - I

Subject Details

No.	Subject Details
FOUNDATION CLASSICAL LANGUAGE : (Select atleast 1 of the following)	
<input checked="" type="checkbox"/>	BASFC101A - SANSKRIT: P1: RITUHARI: NITISHATAK
FOUNDATION : (Select atleast 1 of the following)	
<input type="checkbox"/>	BA0EngC101A - COMPULSORY ENGLISH
<input type="checkbox"/>	BA0HinFC101B - FOUNDATION HINDI: HINDI KAHANI SAHITY: KAHANI NAYI PURANI
CORE : (Select atleast 2 of the following)	
<input type="checkbox"/>	BA0EcoC1010 - ECONOMICS : P1 ELEMENTARY ECONOMICS -I
<input type="checkbox"/>	BA0EcoC1020 - ECONOMICS : P2 INDIAN ECONOMY -I
<input type="checkbox"/>	BA0EngC1010 - ENGLISH: P1 SHORT STORY FORM
<input type="checkbox"/>	BA0EngC1020 - ENGLISH: P2 LYRIC FORM

* Select Checkbox

- Select Program Name, Academic Batch Name and Term. Then Select Check box for your college/Department Subject mapping
- Also View College/Department Subject Mapping

Step : 2

I. Student Subject mapping

- Student Configuration
- Go to Student Configuration select Student Subject mapping

The screenshot displays the BKNMU ERP system interface. The browser address bar shows the URL: <https://department.bknmuerp.in/College/ViewStudentSubjectSelection.aspx>. The page title is "View Student Subject Mapping Details".

On the left sidebar, the "Department" menu is expanded, showing options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The "Student Configuration" option is selected.

The main content area features a form for adding new student subject mappings. A red arrow points to a blue "+" button labeled "Add New Student Subject mapping". Below this are several dropdown menus for "Admission Year" (set to 2022-2023), "College / Department Name", "Program Name", and "Academic Batch Name".

Below the form, there is a table with the following columns: Sr. No., Academic Year, College / Department Name, Program Name, Academic Batch Name, Enrollment Term, Enrollment No., Student Name, Student Type, Is MBP Subject Selection?, View, Edit, and Delete. The table currently displays "No data available in table".

At the bottom of the page, there is a search bar and a "Showing 0 to 0 of 0 entries" message with "Previous" and "Next" navigation buttons.

- Click “ + “ Symbol Add New Student Subject Mapping .

Program Name: BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY Academic Batch Name: BSC(JT) 2022-23

Term: B.Sc(JT) Semester - 1 Syllabus Batch Name: BSC(JT) 2022-23

Stream: -All- Medium: -All-

Subject Details

Levels: -Select All-

No.	Subject Details
<input checked="" type="checkbox"/>	BITcc0010 - PROGRAMMING IN C
<input checked="" type="checkbox"/>	BITcc0040 - ENGLISH LANGUAGE & COMMUNICATION SKILLS
<input checked="" type="checkbox"/>	BITcc0180 - COMPUTER FUNDAMENTALS & EMERGING TECHNOLOGY
<input type="checkbox"/>	BITcc0200 - NETWORKING, INTERNET & WEB PAGE DEVELOPMENT

CORE: (Select atleast 4 of the following)

PRACTICAL: (Select atleast 2 of the following)

<input checked="" type="checkbox"/>	BITpr00180 - PRACTICAL - 1
<input type="checkbox"/>	BITpr00180 - PRACTICAL - 2

Student Details

Student: -Select All-

Submit Cancel

- Select Program Name, Academic Batch Name and Term Syllabus batch Name. Then Select Check box for your Student Subject mapping and also Select Student for this Subject. check all Details after you Submit.
- To delete All student subject selected for click cancel option. Only one student deleted for × click Symbol
- Also View Student Subject Mapping.

II. Release Student Subject Selection

Admission Year: 2022-2023

College / Department: COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Program Name: BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Academic Batch Name: BSC(JT) 2022-23

Syllabus Batch Name: BSC(JT) 2022-23

Term: B.Sc(JT) Semester - 1

Unfreeze

View Students: Subject Selection Release Pending
 Subject Selection Released
 Subject Selection Pending
 Unrelease Subject Selection (Withdrawal Cases)

Specialization: -Please Select

Students Details

Select Checkbox then submit

Sr. No.	Enrollment No.	Student Name	Subject Count	View
1	E22013108001010001	ARDESHNA ANUSHKA KATIBHAI	6	View
2	E22013108001010002	BARVADYA VARTIKA PARSONTAMBAI	6	View
3	E22013108001010003	BHATT LENYBEN YOGESHIBAI	6	View

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.
- Then show view student option Select any one option
 - A. Subject Selection Release Pending,
 - B. Subject Selection Released,
 - C. Subject Selection Pending,
 - D. Unrelease Subject Selection (Withdrawal Cases)

- Show Student Details check All Details and select Check box then Submit to this page.

III. Student Division Mapping

- Go to master and selete program Term Division mapping

The screenshot displays the BKNMU Department Dashboard. The top navigation bar includes the BKNMU logo, a menu icon, the academic year (2022-2023), and a user welcome message. The left sidebar lists navigation options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The main dashboard area features a 'Program Term Division Mapping' button highlighted in a tooltip. Below this are three summary cards: 'NO. OF PROGRAM' (1 College Wise), 'NO. OF STUDENT' (44 College Wise), and 'NO. OF TEACHER' (12 College Wise, 0 College Wise Visiting Teacher). The dashboard also includes several data visualization widgets: 'Program Wise Student' (a pie chart), 'Semester Category And Gender Wise Student' (a table), 'Semester Result Category And Gender Wise Student' (a bar chart), and 'Goal Completion Student' (a progress bar).

	EWS	General	SC	SEBC	ST
Female	7	24	42	17	0
Male	0	29	55	14	0

- Go to College Department > Master and Click Program Term Division
- New Add program Term Division


The screenshot displays the 'Add Program Term Division Mapping' interface in the BKNMU system. The top navigation bar shows the BKNMU logo and the current academic year as 2022-2023. The left sidebar provides navigation to various system sections. The main form area contains several required dropdown fields: Admission Year (2022-2023), College / Department (S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE), Program Name (BACHELOR OF ARTS), Academic Batch Name (B.A. 2022-23), and Term (B.A. Semester -1). Below the form is a 'Division Details' section featuring an 'Add Division' button and a table. The table has the following structure:

Sr. No.	Medium	College Program Type	Division Name	Is Active	Remove
1	None selected-	None selected-		<input checked="" type="checkbox"/>	<input type="button" value="x"/>


At the bottom of the form, there are 'Submit' and 'Cancel' buttons. The Windows taskbar at the bottom shows the system time as 3:51 PM on 13-Dec-22.

- Click “+” Symbol then Add a new program Term Division Mapping.
- No, of Division. example No of Division: -1 open one column and also add one or more Division click add Divi.
- Also View program Term Division Mapping.

- Go to College Department Select Student Division Mapping.



- Click “ + “ Symbol Add New Student Division Mapping.
- Also View Student Subject Mapping.



- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.
- After Select Division, Select Filter option Garnet and select checkbox for Student Details Submit to page.

IV. Student Roll Number

- Go to College Department Select Student Roll Number.

The screenshot displays a web application interface for adding student roll numbers. The interface includes a sidebar with navigation options like Home, Dashboard, Masters, College/Department Configuration, and Student Configuration. The main content area contains several dropdown menus for Admission Year (2022-2023), College/Department (S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE), Program Name (BACHELOR OF ARTS), Academic Batch Name (BA, 2022-23), and Term (B.A. Semester-1). There is a 'Unfreeze' button below these fields. A 'Division' dropdown is set to '-Please Select'. A checkbox labeled 'Generate Roll Nos Automatically?' is checked. Below this, there is a 'Roll No Configuration' section with 'Prefix' and 'Start No.' input fields. The 'Student Details' section includes 'Sorting Type' (Ascending), 'Sorting Preferences' (Name- Father's Name - Surname - Enrollment No), and a 'Generate' button. At the bottom, there are 'Submit' and 'Cancel' buttons. The browser's address bar shows the URL 'https://department.bommu.ac.in/CollegeMasters/AddStudentRollNumber.aspx'.

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name and Freeze Data.
- Select Division. Generate Roll Nos Automatically Click Checkbox. And generate roll no. all student detail show and seat no.

Help Manual

Pre-Examination Module For College

Guj Info Petro Limited

Confidential

This information is confidential and proprietary to GIPL and is to be used only for the purpose for which it is provided. Reproduction by any means, electronic or mechanical, and distribution to third parties without express written permission of GIPL is not permitted.

Table of Contents

1. Generate Provisional Exam Form.....	3
2. Examination Form and College Verification.....	5
3. Activity Wise Payment (Exam Activity)	6
4. Payment Transaction Search.....	7

1. Generate Provisional Exam Form

Insert Functionality:

- The page shall allow the Colleges to generate provisional exam forms in bulk.

The screenshot displays the 'Generate Provisional Exam Form' web application interface. On the left is a dark sidebar with navigation options: HOME, DASHBOARD, MASTER, FEE, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area has a title bar with 'Generate Provisional Exam Form' and a breadcrumb trail 'Home > Generate Provisional Exam Form'. Below the title bar are several dropdown menus for selection: College (COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY), Program (BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY), Program Term (B.Sc.(IT) Semester - I), Exam (BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...), and Exam Type (Regular). An 'Un-Freeze' button is located below these selections. Under the 'Student Details:' section, there is a 'Show' dropdown set to 'All' and a search box. A table lists student details with columns: Sr No., SP ID, Enrolment No, Name, Father Name, Surname, Academic Batch, Enrolment Year, and Specialization / Major Type Name. One student is listed: Sr No. 1, SP ID 20221012805, Enrolment No E22013108001010007, Name KRISHA, Father Name DILIPKUMAR, Surname DHULESHIYA, Academic Batch BSC(IT) 2022-23, and Enrolment Year 2022-2023. Below the table, it says 'Showing 1 to 1 of 1 entries' with 'Previous' and 'Next' navigation buttons. A note states: 'Note : On click of Generate, Provisional Exam Forms would be generated with Latest available Subject Selection from College/Department. Student should approach their College/Department and make necessary changes of their Subject Selection before Submitting Final Exam Forms for Verification.' A 'Submit' button is at the bottom center. An 'Activate Windows' watermark is visible in the bottom right corner. The Windows taskbar at the bottom shows the search bar, task view, and system tray with the time 14:25 and date 14-12-2022.

View Functionality:

- User can View all records.
- Users can also Export/ Delete Multiple records.

The screenshot displays the 'Generate Provisional Exam Form' interface. On the left is a dark sidebar with navigation options: HOME, DASHBOARD, MASTER, FEE, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area features a table with the following data:

Sr No.	College Name	Program Name	Term Name	Exam Name	Regular	Part	Exam Form Generation
1	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
2	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
3	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
4	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1

At the bottom of the table, it says 'Showing 1 to 4 of 4 entries'. The Windows taskbar at the bottom shows the time as 14:25 on 14-12-2022.

2. Examination Form and College Verification

Insert Functionality:

- College User can verify Exam form of students **one by one.**
- College user also selects Answering Language, Payment Information and also change Subject selection if required of selected students.

The screenshot displays the 'Examination Form & College Verification' web application. On the left is a dark sidebar menu with options: HOME, DASHBOARD, MASTER, FEE, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area shows a form for a specific student:

- College:** COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY
- Program:** BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY
- Program Term:** B.Sc.(IT) Semester - 1
- Exam:** BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...
- Enrolment No:** E22013100001010007 - KRISHA DILIPKUMAR... (with a 'Find' button)
- Un-Freeze** button

Student Details:

- Student Name:** KRISHA DILIPKUMAR DHULESHIYA
- Date of Birth:** 04/02/2004
- SP ID:** 20221012805
- Exam Type:** Regular Part
- Answering Language:** --Please Select--
- Is Payment Done by Student at College / Department ?**
- Payment Mode:** --Please Select--
- Student Payment Reference No:** [Text Input]
- Student Payment Date:** DD/MM/YYYY
- Student Payment Remarks:** [Text Area]
- Fee Amount:** 100.0000
- Syllabus Academic Batch:** BSC(IT) 2022-23

Subject Details:

Show 10 entries

Sr No.	Subject Group Name	Subject Name

At the bottom, there is a Windows taskbar showing the search bar, task icons, system tray with temperature (30°C), time (14:49), and date (14-12-2022).

3. Activity Wise Payment (Exam Activity)

Functionality:

- College User can generate challan for bulk of Examination forms.
- Upon generation of challan a unique challan number will be generated which will be used in payments.
- List of applicants will be shown after selected parameter search with having check box selection facility by which bulk payment process will be done.
- Cash and Cheque/ Draft payment options are available for payment.
- If user selects cash challan option, then cash challan will be printed for colleges.
- If user selects Cheque/ Draft option then related Cheque/ Draft No, Date and Bank Name are entered then challan will be printed for colleges.

Applicant List For Payment (Exam Activity Wise)

Home Applicant List For Payment (Exam Activity Wise)

Activity * Examination Form

College * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Faculty * FACULTY OF SCIENCE

Program * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Program Term * B.Sc.(IT) Semester - I

Exam * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...

Exam Type Regular

View

ExamForm Student List:

Show 10 entries Search:

<input checked="" type="checkbox"/>	Enrolment No	Student Name	Student Batch	Exam Type	Payment Done By Student At College
<input checked="" type="checkbox"/>	E22013108001010001	ARDESHNA ANUSHKA YATINBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010002	BARVADIYA VARTIKA PARSOTAMBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010004	BHEDA RAJAN PARBATBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010005	BHETARIYA UMANG ASHOKBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes

Windows watermark: Activate Windows. Go to Settings to activate Windows.

4. Payment Transaction Search

Functionality:

- Using this page, university/ college user can update payment status of offline / online payments with Re-initiate payment.
- Payment list will be populated as per selection of fields.
- In form's list we can see the "No of Students, Payment Information's, Re-initiate Payment"
- In form's list we can delete payment of those whose status is pending.
- User can also export payment list in excel from EXPORT ALL button.
- User can also view students list from "Number of students" field.

Payment Transaction Search

Activity * Examination Form

College Name * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Faculty Name * FACULTY OF SCIENCE

Program Name * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Term * B.Sc.(IT) Semester - 1

Exam * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEM...

Exam Type Regular

Payment Status -- Please Select --

Search Recon Export All Duplicate Payment Data

Payment List:

Show 10 entries Search:

Sr No.	Payment No	Payment Activity	No Of Students	Amount	Payment Mode	Payment Status	Payment Approved	Approved Date Time	Payment Info	Receipt	Re-initiate Payment	Delet
1	EF22121200003	Exam Fees for 2022-2023 Exam - BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1	1	100.00	Cash Challan	Pending	PENDING					Delet

Activate Windows
Go to Settings to activate Windows.